

COVID-19 (કોવિડ -19) રોગચાળા દરમિયાન છેતરપિંડી અને કૌભાંડોથી સાવચેત રહો

ગુનેગારો જાહેરમાં કૌભાંડ કરવા માટે COVID-19 (કોવિડ -19) રોગચાળાનો ઉપયોગ કરી રહ્યા છે - તેનો ભોગ બનશો નહીં.

COVID-19 (કોવિડ -19), નવા કોરોના વાયરસથી થતો રોગ, હવે સત્તાવાર રીતે વિશ્વવ્યાપી રોગચાળો છે. દુનિયાભરના અપરાધીઓ આ સંકટનો ઉપયોગ જનતામાં કૌભાંડમાં કરવા માટે કરી રહ્યા છે, નબળા જૂથોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે જ્યારે તેઓ રોગચાળામાંથી કમાણી કરવા માટે પ્રયાસ કરે છે. Action Fraud (એક્શન ફ્રોડ), યુકેની રાષ્ટ્રીય છેતરપિંડી અહેવાલ સેવાએ, નોંધ્યું છે કે માર્ચ 2020 માં કોરોના વાયરસ સંબંધિત છેતરપિંડીમાં 400% વધારો થયો છે.

પોલીસ અને અન્ય સરકારી સંસ્થાઓ મળીને આ કૌભાંડો અંગેની માહિતી ફેલાવવા અને લોકો છેતરપિંડી સામે જાગૃત છે તેની ખાતરી કરવા માટે મળીને કામ કરી રહ્યા છે.

કાઉન પ્રોસીક્યુશન સર્વિસે નીચેની સલાહ જાહેર કરી છે:

રોકો: તમારા પૈસા અથવા માહિતીથી ભાગ લેતા પહેલા થોભો અને વિચાર કરવા માટે થોડો સમય ફાળવાથી તમે સુરક્ષિત રહી શકો છો.

પડકાર: તે નકલી હોઈ શકે? કોઈપણ વિનંતીઓને નકારવી, ઇનકાર કરવો અથવા અવગણવી તે યોગ્ય છે. ફક્ત ગુનેગારો જ તમને દોડાવવાની અથવા ગભરાવવાની કોશિશ કરશે.

સુરક્ષિત કરો: જો તમને લાગે કે તમે કોઈ કૌભાંડનો ભોગ બની ગયા છો તો તરત જ તમારી બેંકનો સંપર્ક કરો અને Action Fraud (એક્શન ફ્રોડ)માં તેની જાણ કરો.

અમે કૌભાંડના વિવિધ અહેવાલો તરફ જવા માટે સમય ફાળવ્યો છે અને તમારા ધ્યાન પર લાવવા માટે એક સૂચિ બનાવી છે.

* કૃપા કરીને નોંધો કે સૂચિ કોઈ પણ રીતે સંપૂર્ણ નથી અને ગુનેગારો વ્યક્તિઓને લક્ષ્ય બનાવવાની અન્ય રીતો શોધી શકે છે તેથી હંમેશાં જાગૃત રહેવું.

- વાયરસ પરીક્ષણ: વાયરસ પરીક્ષણ કીટ યુકેમાં ફક્ત NHS દ્વારા ઓફર કરવામાં આવે છે.
- રસી / ઉપચાર: COVID-19 (કોવિડ -19) માટે હાલમાં કોઈ રસી અથવા ઉપાય નથી.
- નકલી ઉત્પાદનો: તમારી જાતને કોરોના વાયરસથી બચાવવા માટે અતિશય કિંમતી અથવા બનાવટી ચીજોમાં વધારો થયો છે. આમાં એન્ટીબાયોટિક્સ, માસ્ક વગેરે સામેલ છે.
- ખરીદી / દવા વિતરણ: નબળા લોકોના ઘરના આંગણે અપરાધીઓ તેમને લક્ષ્યાંક બનાવે છે અને તેમને ખરીદી કરવા અથવા દવા પહોંચાડવાની રજુઆત કરે છે.
- સફાઈ સેવાઓ: વાયરસના ફેલાવાને રોકવા માટે સફાઈ સેવાઓ પ્રદાન કરવી.

- ફિશિંગ ઇમેઇલ્સ / ટેક્સ્ટ સંદેશાઓ: દૂષિત જોડાણો ખોલવા માટે છેતરપિંડી કરનારા સંદેશાઓથી સાવચેત રહો જે ફોડર્સ વ્યક્તિગત માહિતી મેળવી શકે છે.

Action Fraud (એક્શન ફોડ) દ્વારા નીચેના ઇ-મેલ્સની ઓળખ કરવામાં આવી છે:

1. ફોડર્સ એક સંશોધન જૂથમાંથી હોવાની બનાવ કરે છે જે રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC) અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ની નકલ કરે છે. તેઓ પીડિતોને તેમના વિસ્તારમાં સક્રિય ચેપની સૂચિ પ્રદાન હોવાનો દાવો કરે છે.
2. છેતરપિંડી કરનારાઓ વાયરસના પ્રકોપ વિશે લેખો પ્રદાન કરે છે, જે બનાવટી કંપની સાથે લિંક હોય છે જેમા પિડીતોને વધુ માહિતી માટે દૈનિક ન્યૂઝલેટર પર સબસ્ક્રાઇબ કરવા માટે ક્લિક કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
3. છેતરપિંડી કરનારાઓ રોકાણ યોજના અને વેપારની સલાહ મોકલીને લોકોને કોરોના વાયરસ મંદીનો લાભ લેવા પ્રોત્સાહિત કરે છે.
4. HMRC માંથી હોવાનો ઢોંગ કરતા છેતરપિંડી કરનારાઓ ટેક્સ રિફંડની ઓફર કરે છે અને પીડિતોને તેમની વ્યક્તિગત અને નાણાંકીય વિગતો એકત્રિત કરવા માટે નકલી વેબસાઇટ પર દિશામાન કરે છે. જો તમને અથવા તમે જાણો છો તે કોઈ વ્યક્તિને ક્રૌભાંડ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે, તો તમારે www.actionfraud.police.uk/ પર જઈને અથવા 0300 123 2040 પર ફોન કરીને Action Fraud (એક્શન ફોડ) ને જાણ કરવી જોઈએ.

કોઈ ક્રૌભાંડ હોઈ શકે છે કે કેમ તેની તપાસ વિશે સલાહ અને માહિતી માટે, અહીં મુલાકાત લો:

www.citizensadvice.org.uk/consumer/scams/check-if-something-might-be-a-scam/.

આ અનુવાદ અમારી સ્વતંત્ર અનુવાદકોની અદ્ભુત ટીમે સ્વૈચ્છિક ધોરણે તૈયાર કર્યો છે.